



8th September, 2022

Manager- Listing Department,

National Stock Exchange India Limited, Exchange Plaza; Plot no C/1, G Block, Bandra Kurla Complex- Bandra (E) Mumbai-400051 Company Symbol: MCL

Dear Sir,

Sub: 10th Annual General Meeting of the Company- Newspaper Publication

Pursuant to the Regulation 47 of Securities Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith the copies of newspaper advertisements published in today's Newspapers viz. Economic Times (Nationwide English Daily) and Sandesh (Gujarati Daily) informing about Completion of dispatch of Notice of the 10th Annual General Meeting along with 10th Annual Report for FY 2021-22.

Please take the same on record.

Thanking you,

Yours faithfully,

For Madhav Copper Limited

COPPER TO BHAYNAGAR S

Sneha Langaliya Company Secretary & Compliance officer THE ECONOMIC TIMES | AHMEDABAD | THURSDAY | 8 SEPTEMBER 2022 | WWW.ECONOMICTIMES.COM

∾=CABINET APPROVES POLICY FOR BOOST TO PROJECTS UNDER PM GATI SHAKTI ~ Rlys Land can be Leased for Up

to 35 yrs, Licensing Fee Slashed

Move expected to help set up 300 cargo terminals, generate 1.25 lakh jobs

New Delhi: The Union cabi-Enet Wednesday allowed longterm lease of up to 35 years for ∞ railway land while substan Etially slashing the land li cence fee to 1.5% per annum of of the land policy overhaul to facilitate projects under the EPM Gati Shakti programme.

The move is expected to help set up 300 cargo terminals and generate 1.25 lakh jobs. "Railway land was earlier

leased for just five years. Now the land can be leased for up to =35 years. This will allow development of more permanent structures on the leased land, union information and broadcasting minister Anurag Thakur said, pointing out that =these decisions had been made -with the intent of promoting =infrastructure and cargo ter-

minals.
"There will be an annual 6% Eincrement in the land licensing Free," Thakur said, briefing retive bidding process. He noted

Infra Focus Railway Land Licensing Fee

lowered to 1.5% annually Lease period increased up to 35 years

Policy will be implemented within 90 days Solar plants to be developed

on rail land at nominal cost Cabinet approves second phase of Kochi Metro

porters on the decisions taken by the union cabinet chaired by Prime Minister Narendra Mo-Railway land is presently

leased out at annual LLF equivalent to 6% of the market value of land. There is a 7% annual increment in the LLF payable. Thakur said that the existing entities using railway land for cargo terminals will have the option to switch to the new

policy regime after a competi-

that a comprehensive policy document will be framed and implemented within 90 days

This lowering of LLF is believed to be in line with NITI Aayog's recommendation to keep it below 3%

of cabinet approval

An official statement said that the amended land policy of the railway is meant to simplify ap provals for utilities as envisaged in PM Gati Shakti. The decision covers cargo related activities, public utilities and railway's exclusive use.

The proposed changes will likely pave the way for privatisation of the Container Corporation of India (Concor) because it will help strategic as land rentals to amounts railways for a longer period, officials explained. This was one of the key suggestions put forward by the investment advisors of Concor. The policy provides for set-

ting up of solar plants on railway land at a nominal cost. It also encourages development of social infrastructure, such as hospitals through publicpartnership private schools through Kendriya Vidyalaya Sangthan on railway land at a nominal annual fee of Rupee1persqm.perannum.

In another decision, the Cabinet approved the second phase of the Kochi Metro Rail Project for ₹1,957.05 crore. This will cover an 11.17 kilometres length with 11 stations from JLN Stadium to Infopark via Kakkanad

⇒STC, MMTC to be Denotified as **™** Nominated Agencies for Trade

Our Bureau

New Delhi: The government will denotify State Trading Corporation (STC), Project & Equipment Corporation (PEC), Metals & Minerals Trading Corporation (MMTC) and STCL Ltd as canalised agencies/nominated agencies for all businesses in the EX-IM policy, the commerce and industry min-

"Theutility of CPSEsvizMMTC, STC and PEC Limited has been examined and it has been decided that there is no need for any canalising agency in this department," the Edepartment of commerce said in an office memorandum dated September 6, adding Ethat a proposal for the closure of the three agencies is under consideration in line ≣with the New Enterprise Policy for CPSEs -in the non-strategic sector.

The three PSUs are under the administrative control of the commerce and industry Eministry which was studying their work.

The government had decided to shutdown many PSUs in 2019 after a review of Einvestments by central public sector entermetals.

prises (CPSEs) in publicly listed state-level entities to ensure that these CPSEs are not saddled with unrelated ventures or loss-

In all, there are around 500 state level pub lic enterprises (SLPEs), of which 200 are loss making.

STC was set up in 1956 as a trading arm of the government to undertake trade with East European countries while PEC was incorporated as a subsidiary of STC in 1971 to handle the canalised business

of export of railway and engineering equipment and became an independent firm in 1997. MMTC was setup in 1963 as an independent entity on separation from STC, primarily to deal in exports of minerals and ores and imports of non-ferrous metals.

As per the memorandum, line ministries can nominate their PSUs wherever re quired. The government also de-notified MMTC as the canalising/nominated agency for the export of ores of high grade iron, chrome, manganese and Red Sanders along with import of copra and precious

Govt Authority also Secured Creditor in IBC: SC

Our Bureau

New Delhi: The Supreme Court has said definition of secured creditor in Insolvency & Bankruptcy Code (IBC) does not exclude any government authority

Legal experts say the judgement will set a precedent for more cases as until now tax dues were generally excluded from the secured creditor list.

The two-judge bench comprising Justice Indira Banerjee and AS Boppana set aside the order passed by National Company Law Appellate Tribunal (NCLAT) in the case of Rainbow Papers vs Gujarat State tax department.

The SC last week ruled that the IBC Act prevails over Customs Act. In the matter of ABG Shipyards, the court ruled that the customs authority has limited jurisdiction over access of duty and other levies when a company is going through insolvency proceedings.

≅ Shah may Pitch for Hindi Use at Official Language Meet on 14th

New Delhi: Union home minister Amit Shah is likely to make a renewed pitch on the use of Hindi during the official language seminar, being held in Surat on Sep-

tember 14, said officials. The ministry has drawn up a detailed plan to propagate Hindi, including by ur-Eging central government offices to make progressive use of Hindi in their work,

"The aim is to promote the use of official Elanguage among central government employees. The second All India Official

Language Conference will be organised

in Surat." It will further help reduce the gap between official Hindi and Hindi used by the public," said a senior government official, who did not wish to be identified.

Officials also pointed out a few instances where IAS or IPS officers, despite being imparted training in Hindi, do not use the language in their official work after joi-

ning the service. "This does not send the right message to

tutional obligation of senior officers of the central government to make use of the language which will further motivate the officials under them," said another

official. On September 14, 1949, the Cons-The first seminar was held in Varanasi last year. tituent Assembly had adopted Hindi as the official language of the Union. Since then, September 14 is annually observed as the official language day.

During the ongoing Azadi ka Amrit Mahotsay, the Centre has been making special efforts to promote, protect, promote and propagate the official langu-

those working under them. It is the constiage. - OPB

Links Core of Strategic

Ties With Russia: PM DipanjanRoy.Chaudhury @timesgroup.com

⊆INSTC, Vladivostok

ω New Delhi: PM Narendra EModi on Wednesday pitched connectivity with Russia via Iran and Vladivostok as the corner stone of its special strategic partnership with Moscow and highlighted immense potential for cooperation with Russia in the field

of energy.

"Whether we talk about the International North-South Corridor, the Chennai-Vladivostok Maritime Corridor or =the Northern Sea Route, connectivity will play an important role in the development of our relations in future, -Modisaid in his remarks deli vered virtually at the seventh Eastern Economic Forum being held in Vladivostok in the presence of Russian Presi-

_dent Vladimir Putin. Modi's address was significant coming ahead of the SCO Summit in Samarkand next week where he could meet Putin for bilateral talks. India plans to connect Northern Sea Route via Arctic to INSTC.

This month marks the 30th anniversary of the establishment of the Consulate of India in Vladivostok. India was the first country to open a =Consulate in this city, "...sin-=ce then, the city has been a witness to many milestones of our relationship," Modi =recalled.

"The forum, established in 2015, has today become a maior global forum for interna-=tional cooperation in the de-Evelopment of the Russian Far East. For this, I appreciate President Putin's vision, and also congratulate him,

MADHAV COPPER LIMITED

Regd. Office: Plot 2107/D, 203, 2rd Floor,D & I Excelus, Opp. Home School, Waghawadi Road, Bhavnagar- 364 001. Phone No: +91 278 3001034 Website: www.madhavcopper.com

NOTICE OF 10" ANNUAL GENERAL MEETING TO BE HELD OVER VIDEO CONFERENCE E-VOTING, RECORD DATE AND OTHER INFORMATION

NOTICE is hereby given that the Tenth Annual General Meeting("AGM") of the Members of MADHAV COPPER LIMITED (Company) will be held on Friday, the 30° September, 2022 at 03:00 PM (IST) through video conferencing("VC")/other Audio Visual Means ("OAVM") facility being provided by National Securities Depositories Limited (NSDL)to transact the business as set out in the notice of AGM as per instruction for joining the AGM electronically in accordance with Circular No. 20/2020 dated 5"May, 2020 read with Circulars dated 8"April, 2020, General Circular dated 13th April, 2020 and General Circular No. 02/2021 dated 13th January, 2021 issued by the Ministry of Corporate Affairs and SEBI Circular dated 12th May, 2020 read with SEBI Circular dated 15th January,

Pursuant to the MCA Circulars mentioned above and SEBI Circular dated May 12, 2020, Members may kindly note that the AGM Notice and Annual Report for the year ended 31"March, 2022 is being sent today electronically, only to such members whose Email Id is registered with the Company's Registrar/ Depository Participant (DP). Those members who have not registered their E mail Id may kindly register with their DP or RTA, Bighare Services at www. bigshareonline.com.

Notice is also hereby given pursuant to Section 91 of the Companies Act, 2013 and regulation 42 of the SEBI Listing Regulations, 2015, the Register of members and share transfer books of the Company will remain closed from Saturday 24, 2022 to Friday 30, 2022 (both days inclusive) for the

The Company will provide its Members, facility of remote e-voting, through electronic voting services provided by NSDL for casting votes on all the business items as set out in the Notice of AGM. Members holding shares and recorded in register of members or in the register of beneficial owners maintained by depositories as on the cut-off date i.e. Friday, September 23, 2022, shall be entitled to e-voting. The remote e-voting shall commence on Tuesday, September 27, 2022 at 09.00 a.m. (IST) and end on Thursday, September 29, 2022 at 05.00 p.m.(IST). The remote evoting will be disabled thereafter. Any person who acquires shares of the Company and becomes member after dispatch of the AGM Notice and holding shares as on cut-off date may obtain the user ID and password by sending request to evoting@nsdi.co.in. or if already registered with NSDL for e-voting then existing user ID and password can be used for casting vote.

Facility for e voting will also be provided at the AGM to only those members who attend the AGM through VC/OAVM and have not cast their vote through remote e-voting. The notice of the AGM is also available at the website of the Company www.madhavcopper.com, at the website of Stock Exchange www.nseindia.com and at the website of NSDL at www.evoting.nsdl.com. In case of any queries relating to e-voting, Members can contact NSDL on their Toll free no.: 1800-222-990 or send a request at evoting@nsdl.co.in on all working days.

In case of queries or issue regarding remote evoting or attending the AGM, please contact ----

Assistant manager, NSDL, 4th floor, 'A wing', Trade world, Kamala Mills compound, Senapati

papat Marg, Lower Parel, Mumbai – 400 013, email Id- evoting@nsdl.co.in, Tel :1800-1020-990.

Place: Bhavnagar For, Madhav Copper Limited Date: 08.09.2022

Sd/ **Nilesh Patel** Chairman & Whole-time Director

13

12

Inflation No Longer Red-lettered; [8] Jobs, Growth are Priorities: FM

Says equitable wealth distribution important; new bill on data privacy 'soon'

Our Bureau

New Delhi: Finance minister Nirmala Sitharaman on Wednesday said inflation was a concern but no longer a 'red-lettered" word. She added that job creation and equitable income distribution were top priorities of the government, while ensuring that the country remains on the path of growth. She added that the new bill on data privacy will be ready "soon"

Some of course are red-lettered (priorities), some may not be. Red-lettered ones would of course be jobs, equitable wealth distribution and making sure India is moving on the path of growth," she said, adding that in that sense inflation is not red-lettered.

"I hope it doesn't surprise many of you. We have shown that in the past couple of months that we were able to bring it to a manageable level," she said addressing the US-India Business Council's India Ideas Summit.

Retail inflation softened to 6.71% in July due to moderation in food prices but remained above the Reserve Bank's comfort level of 6% for the seventh consecutive month. The Consumer Price Index

has remained above 7% from April to June. Sitharaman exuded confidence that the Reserve Bank would manage the volatility emerging from the aggressie rate hike stance of the US

(CPI)-based retail inflation

Talking about fiscal management during the Covid-19 period, she said India with a targeted fiscal policy mana- focus," Sitharaman said.

ropean Central Bank

Federal Reserve and the Eu-



ged through a challenging time without printing money. Sitharaman further under lined that India has the poten

tial to contribute 30% to the global GDP in the next 20 ye She added that India will be taking over the G-20 chair at a very challenging time. However, emerging economies are

the ones that are showing the full potential to lead the global economy in the next few decades 'We will be taking over the G-20 chair at a very challenging time, but it is equally be India and South Africa are all

emerging markets and this is

important because emerging

markets are showing potenti

al to lead the global economy

in the next 50-60 years." "It is the right time to focus on the emerging economies address issues of global con cerns through these economies. Emerging economies are going to be the centre of

Banks told to Speed Up Re Vostro A/cs

Centre asks commerce dept to talk to traders to make payments via SRVA

New Delhi: The Centre has

asked banks to speed up the process of opening special of correspondent (SRVA) banks of partner trading countries to promote crossborder trade in rupees instead of the US dollar. It has also asked the de

partment of commerce to talk to exporters and impor ters to make payment via SRV accounts and negotiate on rupee trade with their trade partners. The centre also suggested allowing setoff of export receivables against import payables and issue of bank guarantee for trade transactions.

According to a detailed recommendation shared with related ministries, the move will remove the through convertible currency, reduce transaction costs and eliminate for eign exchange risk for exporters and importers.

The finance ministry on Wednesday held a meeting with officials from Reserve Bank of India (RBI), the commerce and industry minister and the ministry of external affairs chaired by Sanjay Malhotra, secre-

tary, Department of Financial Service.

Officials aware of the discussions said the move will decrease the pressure on rupee and significantly help partner countries with bal-

ance of payment issues Using this framework, Indian exporters undertaking exports of goods and services shall be paid the export proceeds in Indian Rupee from the balances in the designated Special Vostro account of the correspondent bank of the part ner country

The finance ministry also asked Indian embassies and consulates to spread awareness framework

In July, RBI released a de tailed circular on cross-border trade transactions. making an additional arrangement for invoicing, payment and settlement of exports/imports in Indian currency. "Indian importers undertaking through this mechanism shall make payment in INR, which shall be credited into the Special Vostro account of the correspondent bank of the partner country against the invoices for the supply of goods or services

'Huge Scope to Deepen India, Australia Ties'

Our Bureau

New Delhi: There is huge room for growth in the India-Australia relationship based on both geopolitics and economics, and there is momentum in the relationship, said Lisa Singh, chief executive officer, Australia India Institute.

Singh, who was in the capital for the Australia-India Dialogue, noted that Australia can offer India energy, critical mine rals, decarbonisation and strategic defence technology while India's tech industry can power the nascent but fast-growing industry in Australia.

"This is the fifth dialogue. What is big this time is that both the countries have signed an ECTA... In terms of trade agree ment, outcomes are yet to be realised. I would hope that education, skills, mobility of our two countries become part of that." Singh told ET. India and Australia signed the Economic Cooperation and Trade Agreement (ECTA) in April, under which the latter would give duty-free access to its market for 96.4% of the value of exports (96% of tariff lines), including textiles, le- had now grown

Asked about India's talent pool and need

for easier mobility of professionals, Singh said there was a new government in Australia and they will need to get their policy setting right in terms of investments, ta lent and visas. "Visa system in Australia can do with some overhaul. I think there is work to be done here, but there is an appetite to do it. We need

any other country in the world," Singh added. Mike Cannon-Brookes, co-founder and co-CEO of Australian IT major Atlassian, which is the principal corporate partner for the Dialogue, said India was well pla-

more skilled tech profes-

sionals as well. India pro-

duces more engineers than

ced to transition to higher level tech with its strength in talent. He said Atlassian,

was doing hardcore, world-class R&D here. "It is not a back office kind of an operation. It's huge. One of our fastest businesses effectively," he said. "We are going to triple the size of R&D

and Indians are going to be a big part of it. = 🔊 We are hiring aggressively," he added. He said India to be competitive in IT will need to see the advantages of moving up

the country now to make things happen. "Tone set from the top that is seen in the spirit of doing business here. There is a Ξ

positive change," he said. Singh noted that there was scope for convergence in geopolitical threats both the countries face and the economic imperative and a good example of that was =

DOLAT ALGOTECH LIMITED

(FORMERLY KNOWN AS DOLAT INVESTMENTS LIMITED) Read, Off.: 1401-1409, Dalai Street Commercial Co-op Soc Ltd. Block 53 (Bldg No.53E) Zone-5, Road-5E, Gift city, Gandhinagar - 382355, Gujarat Corp. Off.: 301-308, Bhagwati House, A/19, Veera Desai Road, Andheri (W), Mumbai 400058

Website: www.dolatinvest.com: Email: post@dolatinvest.com CIN: L67100GJ1983PLC126089

NOTICE OF 41⁵⁷ ANNUAL GENERAL MEETING,

NOTICE is hereby given that the 41" Annual General Meeting ('AGM' or 'Meeting') of the mbers of the Company will be held on, Friday, 30" September, 2022 at 4.30 p.m. IST)through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") facility, to ransact the businesses, as set out in the Notice convening the 41" AGM of the Company. In view of the continuing COVID-19 pandemic, the Ministry of Corporate Affairs ("MCA" has vide its General Circular nos. 14/2020 and 17/2020 dated April 8, 2020 and April 13 2020 respectively, in relation to "Clarification on passing of ordinary and special resolutions by companies under the Companies Act, 2013 and the rules made thereunde on account of the threat posed by Covid -19", General Circular no. 20/2020 dated May 5 2020, General Circular nos. 02/2021, Circular No. 21/2021 and Circular No. 2/2022 date January 13, 2021, December 14, 2021 and May 5, 2022 respectively ("MCA Circulars") and Circular No. SEBI/HO/CFD/ CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 and Circular No. SEBI/HO/DDHS/P/CIR/2022/0063 dated May 13, 2022 issued by the Securities Exchange Board of India ("SEBI Circular") prescribing the procedures and permitting holding of the Annual General Meeting ("AGM") through VC/OAVM, without the

n compliance with the aforesaid MCA Circulars and SEBI Circular, Notice of the AGM along with the Annual Report for FY 2021-22 is being sent only through electronic mode to hose Members whose name appear in the Register of Members / Beneficial Owner naintained by the Depositories and whose email addresses are registered with the Company / Depositories/ RTA unless any Member has requested for a physical copy of the same. Members may note that the Notice and Annual Report for FY 2021-22 will also b vailable on website of the Company, i.e. www.dolatinvest.com and website of the Stock

The Register of Members and Share Transfer Books of the Company will remain close from Saturday, September 24, 2022 to Friday, September 30, 2022(both days inclusive) for the purpose of AGM.

Rules under the Act and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is pleased to provide the facility to fembers to exercise their right to vote by electronic means. This facility of casting votes by a Member using remote e-Voting system before the AGM as well as remote e-Voting during the AGM is being provided through Central Depository Services (India) Limited ('CDSL') e

The Company has fixed Friday, September 23, 2022 being cut-off date for determining membe who shall be entitle to avail the facility of remote e-voting as well as e-voting during the AGM in proportion to their share in the paid up equity share capital of the Company.

The remote e-voting will commence at 9.00 a.m. on Tuesday, September 27, 2022 and ends 5.00 p.m. on Thursday, September 29, 2022. The e-voting module shall be disable

fembers who have cast their vote on resolution(s) by remote e-Voting prior to the AGM will also be eligible to participate at the AGM through VC/OAVM but shall not be entitled to cast

The detailed instruction for remote e-voting process before the AGM / remote e-voting during he AGM has been given in the notes forming part of the Notice of the Annual General Me Shareholder will be provided with a facility to attend the AGM through VC/OAVM. The letailed procedure for participation in the meeting through VC/OAVM is given in notes orming part of the Notice of the Annual General Meeting.

Any person who has acquired shares and became members of the Company after lispatch of AGM Notice and holds shares on cut-off date may cast their vote as per nstruction provided in the AGM Notice.

If you have any queries or issues regarding attending AGM & e-voting from the CDSL of oting System, you can write an email to helpdesk, evoting@cdslindia.com or contact at toll ree no. 1800 22 55 33.

o Mr. Rakesh Dalvi, Sr. Manager, (CDSL,) Central Depository Services (India) Limited, A

Sd/ Sandeeokumar G. Bhanushali

Date: 07th September, 2022

Date: 06.09.2022 SD/-Bhupatbhai Bhuva Managing Director DIN-06616061

SHEETAL COOL PRODUCTS LIMITED PLOT NO.75 to 81, G.I.D.C. Estate, Amreli-365601, Gujarat, India Phone: (02792) 240501, info@sheetalicecream.com, www.scolco.com

Members of the Company will be held on Wednesday, September 28, 2022 at 11.00 AM through Video Conference (VC)/ Other Audio Visual Means (OAVM) and pursuant to the applicable provisions the Companies, Act, 2013 ("the act") and the companies (Management and Administration Rules, 2014 ('the Rules") and Securities and Exchange Board of India (Listing Obligation and Disclosure Requirements), Regulations, 2015 ("SEBI Listing Regulations") and other applicable provisions, if any and ther various applicable circulars issued by the Ministry of Corporate Affairs (the "MCA Circulars") and the Securities and Exchange Board of India related to Covid-19. The SHEETAL COOL PRODUCTS LIMITED (the "Company") has on 06.09.2022 completed the dispatch of the 09th Annual General Meeting Notice ("the Notice") through email for seeking approval by of Special and Ordinary resolution in respect of busines intioned in the Notice dated 05.09.2022 and inform to BSE Limited (the

As per applicable provisions of the Companies Act, 2013 read with the Companies (Management and Administration) Rules, 2014 (as amended) and SEBI (Listing Obligation and Disclosure Requirements), Regulations 2015 (as amended) the Company is pleased to provide its Shareholders the acility to cast their vote on the Resolutions set forth in the Notice through ectronic voting system ("Remote E-Voting") of National Securitie Depositories Limited ("NSDL").

1. The Special Business Set Out in the Notice shall be voted only through electronically.

The Company further informs all Members that:

The date of Completion of sending of Notice on 06.09.2022

. The cut-off date for determining the eligibility to vote by remote e-voting is 22.09.2022. Aperson whose name is recorded in the depositories as on cutoff date only shall be entitled to avail the facility of remote e-voting.

The remote e-voting period commences on 25.09.2022 (09:00 A.M. (IST) and ends on 27.09.2022 (05:00 P.M.) (IST).

nstructions and the process of e-mail registration of non-registere nembers to avail Notice & Procedure for "Remote E-voting" in terms of MCA Circulars, is available on the Company's Website -www.scpico.com and or NSDL website www.evoting.nsdl.com

Member are requested to communicate their assent and dissent through Remote E-voting system Only.

contact NSDL helpdesk by sending a request at evoting@nsdl.co.in or contact on: - Tel: 1800 1020 990. In case of any queries or grievance: regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual which is available at www.evoting.nsdl.com under help section or write an email to evoting@nsdl.co.in or contact on: - Tel: 1800

September 23, 2022 to Wednesday, September 28, 2022 (Both days inclusive) for the purpose of 9th Annual General Meeting of the Company.

which started a research and development cent re in India with 140 employees fi

NOTICE OF 9" ANNUAL GENERAL MEETING Notice is hereby given that the 09th Annual General Meeting of the

"Stock Exchange").

3. The Voting Rights of the Members shall being proportion to the Equity Shares held by them in the paid - up Equity Shares Capital of the Compa as on Cut-off date i.e., 22.09.2022.

The AGM Notice, together with explanatory statement, Remote E-voting

B. Shareholders facing any technical issue in login and E- Voting ma

CIN: L15205GJ2013PLC077205

9. The share transfer books of the Company will remain closed from Friday

hysical presence of the Members at a common venue. In compliance with the MCA Circulars, the AGM of the Company is being held through VC/OAVM.

Pursuant to Section 108 of the Companies Act, 2013 ("the Act"), read with the relevan

by CDSL for voting thereafter. their vote on such resolution(s) again.

Wing, 25° Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or all toll free no. 1800 22 55 33.

from the overseas seller /supplier," the circular said.

-21

-8

to 1,400. He pointed out that the company

kes said that was a general enthusiasm in

supply chain issues.

Tel: 9122 267 32602; Fax: 9122 267 32642

REMOTE E-VOTING AND BOOK CLOSURE

oting platform (www.evotingindia.com)

All grievances connected with the facility for voting by electronic means may be addressed

For Dolat Algotech Limited (Formerly known as Dolat Investments Limited)

Company Secretary

-10

યુનિવર્સિટીનો યુવક મહોત્સવ માથે છે ત્યારે ઍમ્ફિથીયેટર્સની હાલત દયનીય

યુનિવર્સિટીના ઍમ્ફિથિયેટર્સનો ગેટ તુટ્યો, ઘાસ ઊગી નિકળ્યુ

યુનિ.ના એસ્ટેંટ વિભાગની આળસને લીધે ઍમ્ફિથીયેટર્સની હાલત ખખડધજ

ા ભાવનગર (સંદેશ પ્રતિનિધિ) । યુનિ.ની એસ્ટૅટ વિભાગની જાળવણીના અભાવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઍમ્ફિથિયેટર્સમાં ગેટ તુટ્યો ગયો છે.આ ઉપરાંત ઘાસ પણ

ઊગી નિકળ્યુ છે. આ અંગે સાંપડતી માહિતી અનુસાર, ભાવનગર યુનિવર્સિટીનો યુવક મહોત્સવ આગામી તા.૧૯ના આરંભ થઈ રહ્યો છે તેવા સમયે યુનિ.ના ઍમ્ફિથિયેટર્સની હાલત બેંહાલ બની ગઈ છે. યુવક મહોત્સવની મહત્વની ઈવેન્ટ ઍમ્ફિથિયેટર્સ પર પ્રસ્તૃત કરવામા આવનાર છે ત્યારે ભાવનગર યુનિ.



ઍમ્ફિથિયેટર્સની હાલત દયનીય બની ગઈ છે. ભાવનગર યુનિવર્સિટીની જાળવણીના અભાવે ઍમ્ફિથિયેટર્સમાં ગેટ તુટ્યો છે.

જ્યારે ઘાસ ઊગી નિકળ્યુ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, યુનિ. પાસે ઍમ્ફિથિયટર્સના રખરખાવ માટે સ્ટાફ ઓછો હોવાનો વાજુ વગાડાઈ રહ્યો છે,તેને લીધે વાસ્તવિકતા બદલાઈ જવાની નથી.

મુખ્ય માર્ગોમા ખાડાઓના કારણે અકસ્માતની રહેતી દહેશત

વલભીપુર પાલિકાની બેદરકારી: ખાડા ખોદયા બાદ કામગીરીમા થતી આળસ

ચાર રસ્તા, મેઈન બજારમા રોજ અસંખ્ય લોકોની અવર જવર

વલભીપુર શહેરમા અનેક રસ્તાઓમા છેલ્લા બે મહિનાથી ખાડા ખોદ્યા પછી પાલિકા દ્વારા કામગીરી આગળ ધપાવાતી નથી. જવાબદાર તંત્ર દ્વારા આંખ આડા કાન થઈ રહ્યા છે.જેના કારણે સામાન્ય જનતાને ભારે હાલાકી વેઠવી પડે છે. મુખ્ય રસ્તામા ખાડાના કારણે અકસ્માતની સંભાવના છે.

વલભીપુરના શાકમાર્કેટ, ભરતભાઈ દેવાણી (સરપંચ) ના ઘર પાસેના ચાર રસ્તા મેઈન બજારમા રોજ અસંખ્ય લોકો અવર જવર કરી રહ્યા છે. અહિ બે મહિના કરતા પણ વધારે સમય થયો છે. હોય જયા ખાડા પાલિકાએ ખોદીયા હોય બે મહિના ઉપર સમય થયો છતાય પાલિકા દ્વારા ખાડા રિપેરિંગ કરતા

મુકવા માગે છે.

સર્ટીફીકેટ ઈશ્યુ કરીશું જે જાણશો.

સર્ટીફીકેટ ઈશ્યુ કરીશું જે જાણશો.

ઘોઘા, મુ.પો.પીપરલા (પીપરલા ગ્રામ પંચાયત) આવેલ જમીન તથા તેમાં આવેલા

પ્રાંધકામ સહિતની મિલકત નં.૪૧૪, જીવરાજભાઈ સાદુળભાઈ પરમાર ની પોતાની

કુલ સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાઓથી મુક્ત

આવેલી હોવાનું જણાવેલ છે કે જેઓ મજકુર મિલ્કત હાઉસીંગ લોન મેળવવા માટે

અમારા અસીલ "માસ રુરલ હાઉસિંગ એન્ડ મોર્ટગેજ કાઈનાન્સ લિ." માં ગીરો

જો સદરહુ મિલ્કતમાં અન્ય કોઈનો લાગભાગ, હક્ક, હિત કે હિસ્સો પોષાતો

આવેલ હોંચતો નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-હમાં નીચે જણાવેલ સરનામે લેખિતમ

પુરાવા સહિત જાણ કરવી જો આમ કરવામાં ચુક થયેથી સદરહું મિલ્કતમાં અન્ય કોઈનો લાગભાગ, હક્ક, હિત કે હિસ્સો આવેલ નથી. તથા તમામે પોતાની

રાજીખુશીથી વેવ/જતો કરેલ છે. તેમ સમજી સદરહૂ મિલ્કતનું ટાઈટલ ક્લીચરન્સ

આથી જાહેર જનતાને જણાવવાનું કે ડિસ્ટ્રીક્ટ, સબ ડિસ્ટ્રીક્ટ બોટાદ, તાલુકો

મરવાળા, મુ.પો.ચાચરીયા (ચાચરીયા ગ્રામ પંચાયત) આવેલ જમીન તથા તેમાં

ઝાવેલા બાંધકામ સહિતની મિલકત નં. 3**હપ, રાણાભાઈ રાજાભાઈ ની પોતાની** કુલ

રવતંત્ર માલિકી કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાઓથી મુક્ત આવેલી

હોવાનું જણાવેલ છે કે જેઓ મજકુર મિલ્કત હાઉસીંગ લોન મેળવવા માટે અમારા

જો સદરહુ મિલ્કતમાં અન્ય કોઈનો લાગભાગ, હક્ક, હિત કે હિસ્સો પોષાતે

ઝાવેલ હોંચતો નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-હમાં નીચે જણાવેલ સરનામે લેખિતમ

યુરાવા સહિત જાણ કરવી જો આમ કરવામાં ચુક થયેથી સદરહું મિલ્કતમાં અન્ય

કોઈનો લાગભાગ, હક્ક, હિત કે હિસ્સો આવેલ નથી. તથા તમામે પોતાની

રાજીખુશીથી વેવ/જતો કરેલ છે. તેમ સમજી સદરહુ મિલ્કતનું ટાઈટલ ક્લીચરન્સ

ખસીલ "માસ રુરલ હાઉસિંગ એન્ડ મોર્ટગેજ ફાઈનાન્સ લિ." માં ગીરો મુકવા

એડવોકેટ: રાજેશ ડી. પરમાર - મો. ૯૩૦૦૧૧૪૧૯૮ ઓફિસ નં. ૩૦૪, ૨૧૩, સુવર્ણદીપ કોમ્પ્લેસ, TBZ Jewellers ની બાજુમાં, વાઘાવાડી રોડ, ભાવનગર



પાલિકાની ઘોર બેદરકારી છતી થવા પામી છે.ત્યારે પાલિકા પાસે કર્મચારીઓના પગાર કરવાના કે માટે રૂપિયા નથી. તથા અમુક

નગરસેવકો દ્વારા ઉચ્ચકક્ષાએ લેખિત રજુઆત કરી હતી.

પાલિકામાં ચીફ ઓફ્સિરના આવા લોકો ની સુવિધા પૂરી પાડવા 🛮 ઠેકાણા નથી. જેથી આડેધડ મોટા પાયે વહીવટો ચાલી રહયા છે. ત્યારે આવી નથી. જેના કારણે પ્રજા હેરાનપરેશાન વિસ્તારમાં સફાઈ થતી નથી. જે સફાઈ અનેક બાબતોથી લોકો હેરાન પરેશાન બાબતે શાશક પક્ષના અમુક થઇરહયાછે.

યુનિવર્સિટી દ્વારા ચાલી રહેલો આંતર કોલેજ રમતોત્સવ ભાઈઓની સેપકટકરોવ સ્પર્ધામાં તક્ષશિલા કોલેજ ચૅમ્પિયન બની

બહેનોની સ્પર્ધામાં ગોપીનાથજી મહિલા કોલેજ વિજેતા બની



બની હતી અને એન.સી.ગાંધી એન્ડ બી

વી.ગાંધી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ

કોલેજ રનર્સ અપ રહી હતી.

આંતર કોલેજ સેપકટકરોવ

ભાઈઓ તથા બહેનોની સ્પર્ધામાં

શારીરિક શિક્ષણ નિયામકશ્રી ડૉ.

દિલીપસિંહ ગોહિલ , તક્ષશીલા

ઇન્સ્ટીટયુટ ઓફ્ કોમર્સ કોલેજના

ટ્રસ્ટી મૌલિકભાઈ પાઠક આચાર્ય

આશિષભાઈ તથા પસંદગી

સમિતિના સભ્યઓ ઉપસ્થિત

માન. સભાસદો,

હાજરી આપવા વિનંતી છે.

તારીખ: ૦૭/૦૯/૨૦૨૨

સ્થળઃ તળાજા.

ા ભાવનગર (સંદેશ પ્રતિનિધિ) ા યુનિ.ના આંતરકોલેજ રમતોત્સવમાં ભાઈઓની સેપકટકરોવ સ્પર્ધામાં તક્ષશિલા કોલેજ ઇન્સ્ટીટયુટ ઓફ્ કોમર્સ ચૅમ્પિયન બની છે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દારા આજે બુધવારના તક્ષશિલા ઇન્સ્ટીટયુટ ઓફ કોમર્સ, કાળીયાબીડનાં યજમાન પદે તક્ષશિલા ઇન્સ્ટીટયુટ ઓફ્ કોમર્સ, ખાતે ભાઈઓ તથા બહેનોની સેપકટકરોવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સેપકટકરોવ ભાઈઓમાં દ કોલેજોનાં કુલ ૩૧ ખેલાડી ભાઈઓએ તથા સેપકટકરોવ બહેનોમાં ૦૩ કોલેજોની કુલ ૨૩ ખેલાડી બહેનોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.જેમા સેપકટકરોવ ભાઈઓમાં તક્ષશિલા ઇન્સ્ટીટયુટ ઓફ્ કોમર્સ ચેમ્પિયન બની હતી અને એમ. જે.કોલેજ ઓફ્ કોમર્સ રનર્સઅપ રહી હતી. સેપકટકરોવ બહેનોમાં

બોટાદ જૈન મંદિરમા શુક્રવારે સંવત્સરી નિમિત્તે આરાધના

બોટાદ : બોટાદમા ગુરૂદેવ કાનજી સ્વામી પ્રેરિત દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર-બોટાદ મધ્યે દશ લક્ષણ પર્વાધીરાજ પર્યુષણ મહાપર્વના અંતિમ દિવસે શુક્રવાર તા. ૯ ના રોજ અંનત ચતુર્દશી સંવત્સરી દિવસ ધર્મ આરાધના પૂર્વક ઉગ્ર -તપ-ત્યાગ કરીને મનાવવામાં આવશે. ભક્તો વિશેષ ધર્મ આરાધના કરશે.સુર્યોદય બાદ સવૃણ કળશથી જિનેન્દ્ર મંગલ અભીષેક થશે. વાસુપૂજય ભગવાનની મોક્ષ કલ્યાણક પૂજા, દશલક્ષણ મંડળ વિધાન પૂજાની પુર્શાહુતિ થશે. કહાન ગુરૂદેવનું ભવતાપ નાશક CD પ્રવચન તથા બપોરે આલોચનાનો પાઠ થશે. જિનેન્દ્ર ભકિત અને સાંજે ૬-૦૦ કલાકે સંવત્સરી મહા પ્રતિક્રમણ થશે. સમસ્ત જિનવૃદની મંગલ આરતી થશે.

કોવાયા ખાતે સિમેન્ટ કોલોની ગણેશ સ્થાપના કરાઈ

સિમેન્ટ કોલોની ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. જેની પૂજા આરતી ભાન્ પરમાર તથા દિનેશ પાંડે અને મહિલા ઉપસ્થિત રહી ગણેશજીની આરતી કરી હતી





બોટાદ પંડિત દિનદયાળ શાળા નં -૧મા શિક્ષક દિન મનાવાયો

બોટાદ પ્રાથમિક શિક્ષણ સમિતિ, મોટાદ સંચાલિત પંડીત દીનદયા**ળ** ાથમિક શાળા નં-૧ તાલુકા શાળા<u>,</u> હનુમાન ગેઈટ બોટાદ માં આજે પ સપ્ટેમ્બર ડો. સર્વપલ્લી રાધાકુષ્ણ રાષ્ટ્રપતિજીના જન્મદિવસ નિર્મિત્તે વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં શિક્ષણ દિન તરીકે ઉજવીને શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ધો- ૧ થી ૮ ના તમામ વર્ગોમાં વિદ્યાર્થીઓ આજે શિક્ષક બનીને વિવિધ વિષયોનું શિક્ષણ કાર્ય શાળાના વિદ્યાર્થી ઓને કરાવ્યુ હતું.

ગૌરવ

મહાલક્ષ્મી ઉ.મા.

ગર્લ્સ હાઈસ્કુલ ધો-

૧૨માં અભ્યાસ કરતી

વિદ્યાર્થીની ડાભી દિશા

અશોકભાઈએ ૧૫ થી

વોલીબોલ ફેડ્રેશન કપ

ઓફ ઈન્ડિયામાં ગુજરાત

તરફથી રમી ઓલ

ઈન્ડિયામાં બીજા નંબર

પ્રાપ્ત કરી મહાલક્ષ્મી ઉ.

મા. ગર્લ્સ હાઈસ્કુલનું

ગૌરવ વધારેલ છે.

૧૭ જુલાઈ

२ ० २ २

બોગલાોર,

કર્ણાટક ખાતે

ટેનિસ

એડવોકેટઃ વિજયકુમાર જી. વડોદરીયા - મો. ૯૯૨૫૫૩૮૫૪૬, ૨૫, ૨૬ તુલશી એમ્પાયર, ગ્રાઉન્ડ ફ્લોર, સ્ટેશન રોડ, બોટાદ મહાલક્ષ્મી ઉ.મા. કર્મચારી રાજ્ય વીમા નિગમ ગર્લ્સ હાઈસ્કુલનું આદર્શ હોસ્પિટલ, બાપુનગર, હરદાસનગર પોલીસ ચોકી પાસે,

બાપુનગર, અમદાવાદ-૩૮૦૦૨૪ • (શ્રમ અને રોજગાર મંત્રાલય, ભારત સરકાર) સૂચક જાહેરાત

ઈએસઆઈસી, આદર્શ હોસ્પિટલ, બાપુનગર, અમદાવાદ તથા નર્સિંગ સ્કૂલ/ડી–૩૪ અમદાવાદ, ગુજરાતના જીએફઆર ૧૩૩(૩) હેઠળ એજન્સીની સેવા આધારિત લમ્પસમ પર વાર્ષિક રિપેરિંગ તથા મેઇન્ટેનન્સ તથા વિશેષ રિપેરિંગ કામ (સિવિલ અને

ઈએસઆઈસી વિવિધ સિવિલ અને ઈલેક્ટ્રિકલ કામો કરવા કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત જાહેર ક્ષેત્રના સાહસો પાસેથી અથવા અન્ય કેન્દ્ર / રાજ્ય સરકાર સંગઠન /પીએસચૂ પાસેથી જે આ હેતુથી ઈ–પ્રોક્યો૨ દ્વા૨ા જીએફઆ૨ ૧૩૩(૩) મુજબ એમઓયૂડી દ્વારા સૂચિત કરાયેલ હોય તેમની પાસેથી ઓનલાઇન બિડો આમંત્રિત કરે છે (સી.પી.પી.પી.).

ઉપરોક્ત કામ માટેના વિગતો, પાત્રતા માનદંડ, પરિશિષ્ટ તથા અન્ય નિયમો અને શરતો http://eprocure.gov.in/eprocure/app પર જોઈ શકાશે અને ડાઉનલોડ કરી શકાશે તથા ૨૮/૦૯/૨૦૨૨ના રોજ બપોરના ૩ કલાક સુધી જમા કરાવી શકાશે. ક.રા.વી.નિ. આ બિડ દસ્તાવેજોમાં કોઈ પણ વધારો/સુધારો કરવાનો અથવા કોઇ પણ તબક્કે કોઈ પણ કારણ દર્શાવ્યા વગર આ ટેન્ડર રદબાતલ કરવાનો અબાધિત અધિકાર ધરાવે છે. સમયમર્યાદામાં વધારો / સ્પષ્ટીકરણ / વધારો / સુધારો, જો હશે તો, તે ઉપરોક્ત વૅબસાઇટ પર જ પ્રકાશિત કરવામાં આવશે.

તબીબી અધીક્ષક

ક.રા.વી.નિ., આદર્શ હોસ્પિટલ, બાપુનગર, અમદાવાદ

नोटीस ::-

આથી અમો પૃથ્વીરાજસિંહ એચ. ગોહિલ, એક્વોકેટ, બી.એ., એલ.એલ.બી., ઠે.ઓફિસ નં. ૩૧૬, ત્રીજા માળે, સાગર કોમ્પલેક્ષ, જશોનાથ સર્કલની બાજુમાં, ભાવનગર મો.નં.૯૪૨૯૭૯૭૯૭૯ તે અમોના અસીલની મળેલ સુચના અને માહિતી મુજબ જાહેર જનતાને આ નોટિસ ઘ્વારા જણાવીએ છીએ કે,

જીલ્લા ભાવનગરમાં સબ- ડીસ્ટ્રીકટ : ભાવનગર, રજીસ્ટ્રેશન સબ- ડીસ્ટ્રીકટ માવનગર- તાલુકાના મોજે અદ્યેવાડો મધ્યે ગામતળમાં આવેલે ઘારાસર અનુક્રેમ નં (મિકલત નં.) ૧૯૮ થી નોંધાચેલ રહેણાંકના હેતુ માટેની મિલ્કત કે જે મિલ્કત ભાવનગર મહાનગર પાલિકામાં એ.સે.સી.કી.ને. ૧૫૦૦૭૯૦૦૦૭૦૦૦૧ થી નોંધાચેલ છે જેનું જમીનનું ક્ષેત્રફળ ૯૭.૯૬ ચો.મી ચાને ૧૧૭.૧૧ ચો.વાર તથા તેના પર આવેલ ઇ કહ્યું કહ્યાળનું ક્ષત્રકૂર્ણ હર્ણ. કર્યા માત્ર ૧૫ ૧૧ તેમાં વાર્ય સાધાર તથા તેના પર આપત ભાંધકામ ક્ષેત્રકૂળ ૯૭.૧૩૫૫ ચો.મી વાળી સ્થાવર મિલ્કત, અમોના અસીલ કિષ્કાના સુખદેવસિંદ ગોહિલ ધારણકર્તા હોચ અને તેઓ સ્વતંત્ર માલિક છે. અને સદરદુ સ્થાવર મીલ્કત પર અમોના અસીલ દીન્દુજા હાઉસીગ ફાયનાન્સ કંપની લીમીટેક ભાવનગર માંથી લોન લેવા માંગતા હોચ જેથી સદરદુ મિલ્કત સબંધે કોઇપણ સખસ, સંસ્થા, કંપની, મંડળી, પૈઢી, કે બેંક, નાણાકીય સંસ્થા કે કોઇનો કોઇપણ પ્રકારનો ભાગ, લાગ, લેણદેણ, હકક હિસ્સો, બોજો, ચાર્જ, લિયન કે ભરણપોષણ કે વારસાઇ હકક કોઇપણ પ્રકારનાં કાયદેસરનાં હકકો કે બોજાઓ હોય તો અમોને આ નોટિસ પ્રસિધ્ધ થચેથી દિન હ માં લેખિતમાં તમામ આધાર પુરાવા સાથે અમારી ઓફિસના સરનામે ર કરવા. મુદત વિતચે કોઈના પણ દકક કે વાંઘા કે તકરાર નથી અને હોય તો વેવ કરેલ દે તેમ માની લેવામાં આવશે અને ટાઈટલને લગતી કાર્ચવાહી આગળ વધારવામાં આવશે જેની સર્વેએ નોંધ લેવી.

સ્થળઃ ભાવનગર, તા. ૮-૯-૨૦૨૨ ૩૧૬, ત્રીજા માળે, સાગર કોમ્પલેક્ષ, જશોનાથ સર્કલ, ભાવનગર

અસીલની સુચનાથી મળેલ સુચના અનુસા **પૃથ્વીરાજસિંહ એચ. ગોહિલ** (એડવોકેટ)



ધી બોટાદ પીપલ્સ કો ઓપરેટીવ બેંક લિ "સરદાર સહકાર ભવન" હવેલી ચોક, પાળીયાદ રોડ, બોટાદ.-૩૬૪७૧૦ રજી.નં.સે/७०૧૩ તા.૧૯-૯-૧૯૯७ લાયસન્સ નંબર : UBD GUJ.1553 P

વાર્ષિક સાધારણ સભાની નોટીસ

વિવારના રોજ સાંજના ૪-૦૦ કલાકે શ્રી સમસ્ત બ્રહ્મરસમાજની વાડી, મસ્તરામ મંદિર પાછળ, પરા, બોટાદ મુક નીચેના કામકાજ માટે મળશે. તો સમયસર હાજરી આપવા વિનંતિ છે.

(૧) ગત વાર્ષિક સાધા રણ સભાની કાર્યવાહીની નોંધ વંચાણે લઇ મંજુર કરવા. (૨) તા-૩૧-૦૩-૨૦૨૨નાં રોજ પુરા થયેલ વર્ષનો બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તૈયાર કરેલ વાર્ષિક અહેવાલ તથા બેંકના ઓડિટ થયેલા વર્ષ આખરનું સરવૈયું, નફા-નુકશાનનાં હિસાબો મંજુર કરવા તથા નફાની ફાળવર્ણ

(૩) તા-૩૧-૦૩-૨૦૨૨ સુધીનાં સમયનો ઓડિટ રિપોર્ટ વંચાણે લેવા બાબત. (૪) સને ૨૦૨૨-૨૦૨૩ નાં વર્ષ માટે ઓડીટરશ્રીની નિમણું ક કરવા તથા મહેનતાણું ચુકવવા બાબત.

પેટાનિયમ-૭ મુજબ બહારથી લેવાના કરજની મર્યાદા નક્કી કરવા. બેંકની વ્યવસ્થાપક કમિટીની યોજવામાં આવેલ ચુંટણીના પરીણામની નોંધ લેવા બાબત. (૭) પ્રમુખશ્રીની સંમતિથી જે કાંઇ રજુ થાય તે અંગે ચર્ચા વિચારણા અને નિર્ણય લેવા બાબત.

તારીખ: ૩૦-૦૮-૨૦૨૨

બોર્ડ ઓફ ડિરેક્ટર્સનાં આદેશથી, ો ચેતનભાઈ જી. ગોત્રીજા

કોરમનાં અભાવે સભા મુલ્તવી રહેશે તો મુલ્તવી રહેલ સભા ફરી તે જ તારીખે કલાક બાદ તે જ સ્થળે ઉપરોક કામો માટે મળશે જેમાં કોરમનો બાધ રહેશે નહી. જે સભાસદોને ફક્ત આ વર્ષના સરવૈયા તથા હિસાબો બાબતે કોઇ માહિતી પૂછપરછ કરવાની હોય તો સાત(૭) દિવસ પહેલા લેખિત અરજી મોકલી આપવી. નિયત સમય મર્યાદા બાદ આવેલ માંગણી

સાધારણ સભા દરમ્યાન આવેલ માંગણી સ્વીકારવામાં આવશે નહી. મિટીંગનું કામકાજ પૂર્ણ થયા બાદ અલ્પાહારની વ્યવસ્થા રાખેલ છે.

સ્વામિનારાયણ મંદિર લોખંડ બજારમા જલઝીલણી ઉત્સવ



ભાવનગર શહેરમાં લોખંડબજારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં બુધવારે પરંપરાગત રીતે જલઝીલણી મહોત્સવ ઉજવાયો હતો. હરિનો નૌકાવિહાર થયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમામ મંદિરોમાં જળઝીલણી એકાદશીની પરંપરાગત રીતે સહજાનંદ સ્વામીની હયાતીના સમયથી આ ઉત્સવની ધામધુમથી ઉજવણી કરાય છે. (તસવીર : કુંદન મકવાણા)

જાહેર સુચના

તાલ્કાલિક ભરતી

તાત્કાલિક છોકરા - છોકરીઓ ભરતી

અનુભવની જરૂર નથી મહીને કમાવો ૧૮,૫૦૦ થી ૨૦,૫૦૦ રહેવા-જમવાની સગવડ ફ્રી મળો.

Mo.9313709891

દિનુભાઇ એમ. પંડિત - પ્રમુખશ્રી

ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સાડાચારસો બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ

(૨જી. ૧૪૧૦, તા. ૨-७-૮૮) **= '૨માવાડી', જ્ઞાતિ છાત્રાલય, ન્યુ સિન્ધુનગર, ભાવનગર**.

(સોળમી વાર્ષિક સાધારણ સભા નોટીસ)

સંસ્થાની ૧૬મી વાર્ષિક સાધારણ સભા તા. ૨૫-૯-૨૨ને

રવિવારના રોજ બપોરે 3-30 કલાકે જ્ઞાતિ છાત્રાલય 'રમાવાડી'

ન્યુ સિન્ધુનગર, ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે. તો દરેક

વાર્ષિક સાધારણ સભાની કાર્ચસૂચિ અને ઓડીટ દિસાબો દરેક આજીવન

સભ્યોને વોટ્સએપ ગ્રુપ દ્વારા મોકલી આપવામાં આવેલ છે. ઓડીટ

રીપોર્ટની કોપી જેઓને જોઈતી હોય તેઓએ કાર્યાલયેથી મેળવી લેવી.

શ્રી તળાજા નાગરિક સહકારી બેક લિ. - તળાજા

'સમન્વય' તિલક ચોક, તળાજા — ૩૬૪૧૪૦ જી.ભાવનગર

झोन.०२८४२ - २२२०६४

૫७ મી વાર્ષિક સાધારણ સભાની નોટીસ

આપણી બેંકની પ૭મી વાર્ષિક સાધારણ સભા તા. ૨૩-૦૯-

૨૦૨૨ ને શુક્રવાર ના રોજ બપોરે ૩:૦૦ કલાકે વારાહી મંદિર

સભાગૃહ, નદીકાંઠે, તળાજા મુકામે, બેંકની મુખ્ય શાખા,

માર્કેટિંગ યાર્ડ શાખા, અલંગ શાખા તથા પીથલપૂર શાખાના

નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરેલ કાર્યસૂચી માટે મળશે. આથી

બેંકના સર્વો સભાસદોએ ઉપરોક્ત જણાવેલ સમયે અને સ્થળે

બોર્ડ ઓફ ડાયરેક્ટર્સશ્રીની સૂચનાથી

શ્રી નીતિનભાઈ જી. ઉપાધ્યાય (CEO)

આજીવન સભ્યોને સમયસર ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી છે.

પર્ચાવરણ મંજુરી

જાહેર સૂચના - પર્ચાવરણ અને CRZ ની મંજૂરી આ સાથે જણાવવામાં આવે છે કે સ્ટેટ લેવલ એન્વાયરમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ઑથોરિટી, (SEIAA) ગુજરાત દ્વારા મેસર્સ ભાવનગર પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને ભાવનગર પોર્ટ (ન્યૂ પોર્ટ), જિલો ભાવનગર, ગુજરાત ખાતે હયાત બંદરની ઉત્તર દિશામાં બ્રાઉન ફિલ્ડ પોર્ટને વિકસાવવા માટેની પર્યાવરણ અને CRZ ની મંજૂરી તારીખ 03 સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ પત્ર ક્રમાંક SEIAA/GUJ/ECCRZ/7(e)/૨૦૪૨/૨૦૨૨ થી આપેલ છે. આ પર્ચાવરણ મંજૂરી ાત્રની નકલ વેબસાઇટ https://seiaa.gujarat.gov.in/ પર ઉપલબ્ધ છે.

તારીખ : ૦૮/૦૯/૨૦૨૨

ભાવનગર પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ

ગારિયાધાર નગરપાલિકા – ગારિયાધાર -ઃઃ જાહેર નિવીદા ઃઃ-

આથી જંતુનાશક દવાનું વેચાણ કરતા GST નંબર ધરાવતા વેપારીભાઇઓ/એજન્સીઓને જણાવવાનું કે, ગારિયાધાર નગરપાલિકા ને જંતુનાશક દવાની ખરીદી કરવાની હોય તેના કોરા ટેન્ડર તા.૧૬-૯-૨૦૨૨ સુધીમાં ટેન્ડર ફ્રી રૂા. ૩૦૦/- ભરીને (રજાના દિવસો સિવાય) મેળવેલા ટેન્ડરો ભરીને ભરેલા ટેન્ડરો તા.૨૧-૯-૨૦૨૨ સુધીમાં - "ચીફ ઓફિસર" નગરપાલિકા ગારિયાધાર ના નામે રજી.પોસ્ટ એડી.થી મોકલવાના રહેશે. (કવર ઉપર કામનું નામ લખવાનું રહેશે.)

જા.નં.૪૦૭/૨૦૨૨ તા.૭-૯-૨૦૨૨ (એચ. પી. બોરડ) (ઓદ્યાભાઈ એસ. પરમાર) (પ્રકુલભાઈ એલ. કાત્રોડીયા) ચીફ ઓફિસર **В**ЧУНУ

ગારીયાધાર નગરપાલિકા

જાહેર નોટીસ

અમો નીચે સહી કરનાર જમાલભાઈ રહેમાનભાઈ કેરૈયા રહે.જુની માણેકવાડી,ડો.અંધારીયાનો ડેલો, ભાવનગર રહે.વડવા પાળીયાધાર,બારૈયા શેરી,ભાવનગરના તે લાગતા વળગતા તમામ હીત ધરાવતા જોગ તેમજ જાહેર જનતા જોગ આ જાહેર નોટીસથી જણાવવાનુ કે:-

અમોની સ્વપાર્જીત તેમજ અમોની પત્ની ગુજ.જુબેદાબેન જમાલભાઈ કેરૈયાના નામે આવેલી સ્થાવર જંગમ મિલકતોમાં અમોના પુત્રો (૧)સરફરાજ જમાલભાઈ ડેરૈયા (૨) નિઝામ જમાલભાઈ ડેરૈયા (૩) રેહાના જમાલભાઈ ડેરૈયા (૪)મુસ્તુફા જમાલભાઈ ડેરૈયાનો કોઈપણ જાતનો હકક દીત દીસ્સો દું આપવા માંગતો નથી અને મે તેઓને મારી તેમજ મારી ગજ.પત્નીની આવેલી તમામ સ્થાવર જંગમ મિલકતમાંથી તેઓને બેદખલ કરેલ છે અને મારા પિતા તરીકેના તમામ પ્રકારના સામાજીક વ્યવહારો કાપી નાંખેલ છે અને તેઓ સાથે મારી કશી લેવા દેવા છે નહી અને આ મિલકતોમાંથી હું મારા સંતાનોને કોઈપણ જાતનો વારસાઈ હકક,હીત હીસ્સો આપવા માંગતો નથી, જેથી કોઈપણ વ્યક્તિ,બેક,પેઢી,મંડળી,એસોસીએશન,ટ્રસ્ટ વગેરે મારા સંતાનો સાથે કોઈપણ જાતના આર્થીક કે અન્ય પ્રકારનો વ્યવહારો કરશે તો તેઓની પોતાની જવાબદારીએ કરશે જેમા અમોની કોઈ જવાબદારી રહેશે નહી તે સબંધે મને કોઈએ કોઈપણ રીતે સંપર્ક કરવો નહીં, તેની જાહેર જનતાએ નોંધ લેવી.

ભાવનગર **ส**. 0७-06-२0२२ સહીઃ જમાલભાઇ રહેમાનભાઇ કેરૈયા અમોના અસીલની સુચના અને માહિતી અનુસાર જે.કી. કેડા

માધવ કોપર લિમિટેડ

CIN:- L27201GJ2012PLC072719

રજીસ્ટર્ડ ઓફીસ : પ્લોટ નં ૨૧૦७/ફી, ઓફીસ નં. ૨૦૩, બીજો માળ, ડી એન્ડ આઈ એક્સેલસ, વાઘાવાડી રોડ, ભાવનગર गुक्टात - उड४००१, होन :- +६१ ०२७८ ३००१०३४, २५९४७९५

10મી વાર્ષિક સાધારણ સભા

સૂચના આપવામાં આવે છે કે માધવ કોપર લિમિટેક (કંપની) ના સભ્યોની ૧૦મી વાર્ષિક સામાન્ય સભા, સપ્ટેમ્બર, ૨૦૨૨ના ૩૦મી તારીખ, શુકવારે, બપોરે ૩:૦૦ વાગ્ચે ચોજાશે. (IST) કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્ર ૧૩મી એપ્રિલ, **૨૦૨૦ અને ૫ મી, મે ૨૦૨૦ ના પરિપત્રો સાથે વાંચેલા ૫ મે. ૨૦૨૦ ના પરિપત્ર નંબર ૨૦/૨૦૨૦ મુજબ, એજીએમ વિકિઓ** કોન્કરન્સ(વીસી)/ અન્ય ઓડીઓ વિઝ્યુબલ મીન્સ દ્વારા યોજવામાં આવી રહ્યું છે એજીએમની નોટિસમાં નક્કી કર્યા મુજબ જ ધંધાનો વ્યવહાર કરવા માટે નેશનલ સિક્ચોરિટીઝ ડિપોઝિટરીઝ લિમિટેડ (એનએસડીએલ) દ્વારા (ઓએવીએમ) સુવિધા આપવામાં આવી રહી છે. ઇલેક્ટ્રોનિક રૂપે એજીએમમાં જોડાવા માટેની સૂચનાઓ એજીએમની સૂચનામાં આપવામાં આવી છે

ઉપર જણાવેલ એમસીએના પરિપત્રીને અનુલક્ષીને અને સેબીના પરિપત્ર તા ૧૨ મે, ૨૦૨૦ ના રોજ સભ્યોએ નોંધ લેશો કે ૩૧ માર્ચ, ૨૦૨૨ ના રોજ પૂરા થયેલા વર્ષનો એજીએમ નોટિસ અને વાર્ષિક અદેવાલ જેમના ઈમેઈલ આઈડી સાથે નોંધાયેલ છે અઓને ઈલેક્ટ્રોનિક રીતે મોકલવામાં આવી રહ્યો છે. કંપનીના રજિસ્ટ્રાર/ડિપોઝિટરી સહભાગી (ડીપી) જે સભ્યોએ પોતાનો ઇ મેલ આઇડી નોંધાવ્યો નથી તે કુપા કરીને તેમના ડીપી અથવા આરટીએ સાથે નોંધણી કરાવી શકે છે.

કંપનીઓ અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૯૧ હેઠળ પણ નોટિસ આપવામાં આવી છે, કંપનીઓ (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) નિયમો ૨૦૧૪ના નિચમ ૧૦ સાથે વાંચવામાં આવે છે કે કંપનીના સભ્યોની રજીસ્ટર શેર ટ્રાન્સફર બુક્સ શનિવાર, ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ થી બંધ રહેશે અને એજીએમના હેતુ માટે 30 સપ્ટેમ્બર, ૨૦૨૨ ને શુક્રવાર, (બંને દિવસ સહિત).

કંપની એજીએમની સૂચનામાં જણાવેલ તમામ વ્યવસાયિક વસ્તુઓ પર મત આપવા માટે એનએસડીએલ દ્વારા પૂરી પાડવામાં આવતી ઇલેક્ટ્રોનિક મતદાન સેવાઓ દ્વારા તેના સભ્યોને રિમોટ ઇ-વોટિંગની સુવિધા પ્રદાન કરશે.શેર ધરાવતા અને સભ્યોના રજિસ્ટરમાં નોંધાચેલા સભ્યો અથવા કિપોઝિટરી દ્વારા જાળવવામાં આવેલા લાભકારક માલિકોના રજિસ્ટરમાં નોંધાચેલા સભ્યો એટલે કે શુકવાર, ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૨, ઈ મતદાનનો હકદાર રહેશે. રિમોટ ઇ-વોટિંગ મંગળવાર, ૨७ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ સવારે ૯.૦૦ વાગ્યે (IST) થી શરૂ થશે અને રહ સપ્ટેમ્બર, ૨૦૨૨ ને ગુરૂવારે ૦૫.૦૦ વાગ્ચે (IST) પર સમાપ્ત થશે ત્યારબાદ ઇ-મતદાન અક્ષમ કરવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ કે જે કંપનીના શેરો મેળવે છે અને એજીએમ નોટિસ મોકલ્યા પછી સભ્ય બને છે અને સમય પૂર્ણ થયા બાદ શેર हોલ્ડ કરે છે તે યુઝરે આઈડી અને પાસવર્ડ evoting@nsdl.co.in પર વિનંતી મોકલીને મેળવી શકે છે.અથવા જો પહેલેથી જ એનએસડીએલ સાથે ઇ-

વોટિંગ માટે નોંધાયેલ છે તો હાલના વપરાશકર્તા આઈડી અને પાસવર્ડનો ઉપયોગ મતદાન કરવા માટે કરી શકાય છે

ઈજા મતદાન માટેની સવિધા એજાએમ પર ફક્ત તે જ સભ્યોને આપવામાં આવશે કે જેઓ વીસી/ઓએવીએમ દ્વારા એજીએમમાં હાજર હોય અને પોતાનો મત ન આપ્યો हોય. એજીએમની સુચના કંપની www.madhavcopper.com વેબસાઇટ, સ્ટોક એક્સચેંજ www.nseindia.com ની વેબસાઇટ અને www.evoting.nsdl.com પર એનએસડીએલની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. ઈવોટિંગ સંબંધિત કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં, સભ્યો શેરહોલ્ડરો માટે વારંવાર પૂછાતા પ્રશ્નો (એફએક્યુ) નો સંદર્ભ લો અને www.evoting.nsdl.com ના કાઉનલોક વિભાગ પર ઉપલબ્ધ શેરહોલ્કરો માટે ઈ-વોટિંગ વપરાશકર્તા માર્ગદર્શિકા અથવા ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકે છે . ૧૮૦૦-૨૨૨-૯૯૦ અથવા એન.એસ.ડી.એલ. ને evoting@nsdl.co.in તથા email ID: pratikb@nsdl.co.in or at telephone no. +e٩-२२-२४∈६४७३८, અથવા email ID: saritam@nsdl.co.in or at telephone nos.: +૯૧-૨૨-૨૪૯૯૪૮૯૦ પર વિનંતી મોકલો.

તારીખઃ ૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૨

ફોર માધવ કોપર લીમીટેડ SD/- श्री निलेश पटेल (येरभेन)